

જૂન-૨૦૧૮થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી નવી “નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓ અને નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વધારાના નોન ગ્રાન્ટેડ વર્ગો” શરૂ કરવાની પરવાનગી માટે દરખાસ્ત રજૂ કરવા જોગ

## જાહેરાત

જૂન-૨૦૧૮થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી જે ટ્રસ્ટ/સંસ્થા /કંપની નવી નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળા (ધોરણ-૧ થી ૫) અને નવી નોન ગ્રાન્ટેડ ઉચ્ચ ખાનગી પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) સ્થાપીને પ્રાથમિક શિક્ષણ આપવા માગતી હોય તેવા ટ્રસ્ટ/સંસ્થાઓ/કંપની આ કચેરીની વેબ સાઇટ [www.vidyasahayak.gujarat.org](http://www.vidyasahayak.gujarat.org). તથા [www.ptcgujarat.org](http://www.ptcgujarat.org) ઉપરથી અરજી પત્રક (નમૂનો-૧) અપલોડ કરી અને પ્રિન્ટ કરી આધારો સાથે તા.૨/૧/૨૦૧૮ થી ૨૨/૧/૨૦૧૮ સુધીમાં જે તે જિલ્લાના જિલ્લા અધિકૃત અધિકારીશ્રી એટલે કે જિલ્લા પંચાયતો વિસ્તાર માટે જે તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અધિકૃત નગરપાલિકા/મહાનગર પાલિકા તથા કેન્ટોનમેન્ટ વિસ્તાર માટે જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અરજી કરવાની રહેશે. આ અરજીની હાર્ડ કોપી તા.૨૫/૧/૨૦૧૮ સુધીમાં જે તે જિ.શિ.અધિ./જિ.પ્રા.શિ.અધિ.ની કચેરીમાં જમા કરાવવાની રહેશે. અરજી ફી: નવી ખાનગી પ્રાથમિકશાળા/નવી ખાનગી ઉચ્ચ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે અરજી સાથે રૂ.૨૫,૦૦૦/- અને વધારાના /ક્રમિક વર્ગો ખોલવાની અરજી સાથે દરેક વર્ગ દીઠ રૂ.૫,૦૦૦/- ની ફી રકમ “ 0202-01-પ્રાથમિક શિક્ષણ-800-અધર રીસીપ્ટ” સદરે સરકારી તિજોરીમાં જમા કરાવી ચલનની અસલ પ્રત સંબંધિત અરજી સાથે જોડવાની રહેશે. આ ફી ની રકમ કોઈપણ સંજોગોમાં પરત મળવાપાત્ર નથી. ધોરણ-૧ થી ૫ ની પ્રાથમિક શાળા અને ધોરણ-૬ થી ૮ ની ઉચ્ચ પ્રાથમિક શાળા અલગ-અલગ એકમ ગણાશે. તેથી જો બંને વિભાગ માટે અરજી કરવાની હોય તો અલગ-અલગ વિભાગ દીઠ રૂ.૨૫,૦૦૦/- ફી ભરવાની રહેશે.

**અરજી કોણ કરી શકશે:** મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ હેઠળ અથવા મંડળી રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૬૦(સન-૧૯૬૦ના ૨૧માં) હેઠળ રજિસ્ટર્ડ થયેલ મંડળી અથવા તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા કંપની અધિનિયમ-૧૯૫૬ (સન-૧૯૫૬ના પહેલા) ની કલમ-૨૫ હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય એવી સંસ્થા અરજી કરી શકશે. વેબ સાઇટ પર શાળાની માન્યતાના માપદંડો, અરજી સાથે રજૂ કરવાના આધાર વગેરેની માહિતી મુકવામાં આવેલી છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજી કરવા જણાવવામાં આવે છે.

નવી શાળા શરૂ કરવા અંગે: શાળા શરૂ કરવા માગતા શાળા ટ્રસ્ટ/સંસ્થા/કંપનીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો:૧૯૪૯ ના નિયમ-૧૦૬ હેઠળ તેમજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ(આર.ટી.ઈ.એક્ટ)-૨૦૦૯ની કલમ-૧૯ અને ૨૫ હેઠળ શાળા માટે નિયત થયેલા ધોરણ અને માપદંડ મુજબ જરૂરી મકાન, સ્ટાફ, ભૌતિક સુવિધાઓ, ગ્રંથાલય અને રમતના મેદાન સહિત ખેલફૂલની સાધન સામગ્રી હોવી જરૂરી છે.

તા. ૩૦/૧૨/૨૦૧૭

સ્થળ: ગાંધીનગર

(એમ.આઈ.જોષી)

પ્રાથમિક શિક્ષણ નિયામક

ગુ.રા.ગાંધીનગર